

તા.૧૬/૦૯/૨૦૨૧

પ્રતિ,
તંત્રીશ્રી,
દૈનિક.....

આવતીકાલે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે

શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મેયરશ્રી ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા દ્વારા બેઠક યોજાઈ : વેક્સિનેશનમાં બાકી રહેલા લોકોને આ ઓફલાઈન વેક્સિનેશન મહાઅભિયાનમાં લાભ લેવા અપીલ

રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, તેમજ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેક્સિનેશન સાઈટ : ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સિનેશન થશે: વિવિધ સ્થળોએ મોબાઈલ વાહન દ્વારા પણ વેક્સિનેશન થશે





આવતીકાલે તા.૧૭-૦૯-૨૦૨૧ના રોજ ભારતના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિ નેશન મહાઅભિયાન યોજાશે. આ અનુસંધાને શહેરની વિવિધ સંસ્થાઓ સાથે આજે તા.૧૬-૦૯-૨૦૨૧ના રોજ મેયરશ્રી ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. માન. મેયર શ્રી ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન મહાઅભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે.

આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, તેમજ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેક્સીનેશન સાઈટ : ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે અને અન્ય વિવિધ સ્થળોએ મોબાઈલ વેક્સીનેશન વાન મોકલીને વેક્સીનેશન થશે. આ મહાઅભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે.

મ્યુનિ. કમિશનર શ્રી અંત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનરશ્રીઓ, આસીસ્ટન્ટ કમિશનરશ્રીઓ, અન્ય વહીવટી અધિકારીશ્રીઓ, તબીબો વગેરેને જુદીજુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર સહિત ૩૧ કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ થઈ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જ્યારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને ૮૪ દિવસ થઈ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે અને ૮૪ દિવસ થઈ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઈ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

તા.૧૭/૦૮/૨૦૨૧ના રોજ સરકાર દ્વારા વેક્સિનનો ખુબજ મોટો જથ્થો આપવામાં આવનાર હોઈ શહેરના નગરજનોને વેક્સિન લેવા ડૉ.પ્રદિપ ડવ , ડે.મેયર, ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઈ પટેલ , મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા , શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, ઇન્ડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

આરોગ્ય કેન્દ્રની માહિતી દર્શાવતું પત્રક

| ક્રમ | ઝોન | વોર્ડ નં. | આરોગ્ય કેન્દ્રનું નામ | આરોગ્ય કેન્દ્રનું સરનામું |
|------|--------------|-----------|---------------------------------------|---|
| ૧ | સેન્ટ્રલ ઝોન | ૭ | સદર આરોગ્ય કેન્દ્ર | શાસ્ત્રી મેદાન પાસે, કુંડલીયા કોલેજની બાજુમાં |
| ૨ | | ૨, ૩ | જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર | ટેલ્વે જંકશન સામે, વોર્ડ ઓફીસની બાજુમાં |
| ૩ | | ૭ | રામનાથપરા આરોગ્ય કેન્દ્ર | રામનાથપરા, શેરી નં.-૨૪ |
| ૪ | | ૧૩ | નારાયણનગર આરોગ્ય કેન્દ્ર | નારાયણ નગર,મેઈન રોડ, ઢેબર રોડ ફાટક સામે |
| ૫ | | ૧૪ | અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર | લક્ષ્મીવાડી મેઈન રોડ, ગાત્રાળ ચોક |
| ૬ | | ૧૭ | ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર | બાબરીયા મેઈન રોડ, રઘુવીર સોસાયટી |
| ૭ | | ૧૭ | હુડકો આરોગ્ય કેન્દ્ર | કોઠારીયા મેઈન રોડ, હરીઘવા રોડ, પોલીસચોકી સામે |
| ૮ | ઈસ્ટ ઝોન | ૪ | ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર | ભગવતીપરા શેરી નં.- ૫ |
| ૯ | | ૪ | મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર | મોરબી રોડ, જકાતનાકા |
| ૧૦ | | ૫ | આઈ. એમ. એ. આરોગ્ય કેન્દ્ર | પેડકરોડ, સંત જ્ઞાનેશ્વર સ્કૂલની બાજુમાં |
| ૧૧ | | ૬ | કબીરવન આરોગ્ય કેન્દ્ર | કબીરવન સોસાયટી શેરી નં.-૧, સંતકબીર રોડ |
| ૧૨ | | ૬ | રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર | રામપાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ |
| ૧૩ | | ૧૫ | સ્વ. શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર | અંબેડકર નગર ગેઈટની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, રાજકોટ |
| ૧૪ | | ૧૬ | પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર | પ્રણામીચોક, સિયાણીમેઈન રોડ |
| ૧૫ | | ૧૮ | કોઠારીયા આરોગ્ય કેન્દ્ર | પારડી રોડ, કોઠારીયા ગામ |
| ૧૬ | વેસ્ટ ઝોન | ૧,૨ | શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર | બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર ૪/૫ નો ખૂણો, ગાંધીગ્રામ |
| ૧૭ | | ૭ | વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર | વિજય પ્લોટ મેઈન રોડ, આર.પી. ભાલોડિયા કોલેજ સામે |
| ૧૮ | | ૮ | નાના મોવા આરોગ્ય કેન્દ્ર | નાના મોવા ચોકડી પાસે |

| | | | |
|----|-------|----------------------------|---|
| ૧૯ | ૯, ૧૦ | નંદનવન આરોગ્ય કેન્દ્ર | નંદનવન સોસાં. ગાંધીગ્રામ પોલીસચોકી સામે |
| ૨૦ | ૧૧ | મવડી આરોગ્ય કેન્દ્ર | મવડી ગામ દાદા મેકરણ ચોક, મવડી રોડ |
| ૨૧ | ૧૨ | આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર | આંબેડકરનગર, ગોકુલધામ મેઈન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા |

| ઝોન | વોર્ડ નં. | વોર્ડ ઓફીસનું સરનામું |
|----------|-----------|---|
| સેન્ટ્રલ | ૨૨અ | ગીત ગુજરી સોસા., રામેશ્વર ચોક, ડ્રેનેજ પમ્પીંગ સ્ટે. પાસે |
| | ૨બ | બજરંગવાડી મેઈન રોડ |
| | ૨ક | શ્રોફ રોડ, પાણીની ટાંકીની બાજુમાં |
| | ૩અ | બેડીનાકા ટાવર પાસે, પમ્પીંગ સ્ટે., કેશરી હિંદ પુલ પાસે |
| | ૩બ | જંકશન પોલીસ ચોકી પાસે, જંકશન પ્લોટ |
| | ૩ક | પોપટપરા પમ્પીંગ સ્ટેશન પાસે |
| | ૭અ | એસ્ટ્રોન સિનેમા પાસે, શિવાજી પાર્ક પાસે, ટાગોર રોડ |
| | ૭બ | વિજયપ્લોટ, અવંતિકાબાઈ હોલ પાસે |
| | ૭ક | કરણસિંહજી હાઇસ્કૂલ પાસે, અપના બજાર સામે, ભુપેન્દ્ર રોડ |
| | ૭ડ | હાથીખાના, આર્યસમાજ પાસે, શ્રી મનોહરસિંહજી ઓફીસ પાસે |
| | ૧૩અ | કૃષ્ણ નગર મેઈન રોડ, ગુરુપ્રસાદ સોસા.ની બાજુમાં |
| | ૧૩બ | અમરનગર મેઈન રોડ, શાળા નં-૮૧ પાસે |
| | ૧૩ક | ૮૦ ફૂટ રોડ, ગોકુલ ધામ આવાસ યોજના સામે |
| | ૧૪અ | સિંદુરિયા ખાણ શોપિંગ સેન્ટર પાસે, કોઠારીયા રોડ |
| | ૧૪બ | લાકડિયા પુલ, કોઠારીયા કોલોની સામે, બગીચા સામે |
| | ૧૪ક | ભક્તિનગર સોસા., ગુરુકુળ દરવાજા સામે, ઢેબર રોડ |
| | ૧૪ડ | કુંકુબાઈ જળાશય પાસે, ગુંદાવાડી ૫/૨૩ નો ખુણો |
| | ૧૭અ | સહકાર નગર મેઈન રોડ, શાળા નં.૫૧ની બાજુમાં |
| | ૧૭બ | અટીકા ઇન્ડ. એરિયા, વેલડોરની બાજુમાં, ઢેબર રોડ |
| | ૧૭ક | સુખરામનગર, પાણીનાં ટાંકા પાસે |
| વેસ્ટ | ૧ | રામાપીર ચોકડી, ફાયર બ્રિગેડ બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ |
| | ૮અ | સોજીત્રા નગર, પમ્પીંગ સ્ટે.સામે, રૈયા રોડ |
| | ૮બ | નાના મવા સર્કલ, જય પાર્ટી પ્લોટની બાજુમાં |
| | ૮ક | રાજનગર ચોક |
| | ૮ડ | જનકલ્યાયપ્લાટક, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની બાજુમાં |
| | ૮અ | પેરેડાઈઝ હોલ પાસે, ત્રિલોક પાર્ક પાસે |

| | | |
|------|-----|---|
| | ૯બ | કિસ્મત હોટલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે |
| | ૧૦અ | ૧૫૦ ફૂટ રીંગ રોડ, રોયલ પાર્ક-૦૮ કોર્નર |
| | ૧૧અ | નાના મવા સર્કલ પાસે |
| | ૧૨અ | મવડી રોડ, ૧૫૦ફૂટ રીંગ રોડ, જીથરીયા હનુમાન પાસે |
| | ૧૨બ | વાવડી ગ્રામ પંચાયત ઓફીસ |
| ઈસ્ટ | ૪અ | જુના સીટી સ્ટેશનની બાજુમાં મોરબી રોડ |
| | ૪બ | લાતી પ્લોટ, ૫/૧૨નાં ખૂણે |
| | ૫અ | રણછોડદાસજી આશ્રમ સામે, કુવાડવા રોડ |
| | ૫બ | હુડકો કોમ્યુનીટીની બાજુમાં, આર.ટી.ઓ. ની પાછળ |
| | ૫ક | ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે, આર્યનગર મેઈન રોડ |
| | ૫ડ | ઓડીટોરીયમ પાસે, પેડક રોડ |
| | ૬અ | શકિત ઇન્ડપ્સ્ટ્રીઝ શેરી નં.૩, કબીરવન મે.રોડ |
| | ૬બ | માંડા ડુંગર મેઈન રોડ |
| | ૬ક | રાજમોતી ઓઇલ મીલની બાજુમાં, ભાવનગર રોડ |
| | ૧૫અ | કન્ઝેરવન્સી સ્ટોઝરની બાજુમાં ૮૦ ફૂટ રોડ |
| | ૧૫બ | દુધસાગર માર્ગ, મધર ટેરેસા સ્કુલની બાજુમાં |
| | ૧૬અ | મેહુલ નગર-૬, નીલકંઠ સિનેમા પાછળ |
| | ૧૬બ | વિવેકાનંદ વોકળા કાંઠે |
| | ૧૬ક | અરવિંદ મણિયાર હુડકો કવા. પાણીનાં ટાંકા પાસે |
| | ૧૮અ | સુખરામનગર, પાણીનાં ટાંકા પાસે |
| | ૧૮બ | કોઠારીયા ગામ |
| | ૧૮ક | કોઠારીયા સોલ્વન્ટ પાણીનો ટાંકો |

(પી.એ. ટુ મેયર)